



જિલ્લા શિક્ષણાધિકારી કચેરી - રાજકોટ

શ્રી કરણસિંહજી હાઈસ્કૂલ બિલ્ડીંગ, સીટી ગેસ્ટ હાઉસ સામે, ભુપેન્દ્ર રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧.

ફોન નં : (૦૨૮૧) ૨૨૨૩૪૫૩

Email : rajkotdeo@gmail.com

ક્રમાંક : માધ્ય/ખ-૧/૨.હે.ઉ.સ./પરિપત્ર/૨૦૨૨/૧૨૮૭૪-૧૩૧૦૧

તા. ૧૮/૧૨/૨૦૨૨

ઈ-મેઈલ દ્વારા

પ્રતિ,

આચાર્યશ્રી,

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ,

જિ.રાજકોટ.

વિષય : ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત નવા ચેકલિસ્ટ અને પ્રમાણપત્ર મુજબ રજૂ કરવા બાબત.

સંદર્ભ : (૧) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૦૫/૦૭/૨૦૧૧.

(૨) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: બમશ/૧૦૧૧/૧૪૧૮/ગ, તા. ૦૨/૦૧/૨૦૧૨.

(૩) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૧૩/૧૦/૨૦૧૫.

(૪) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૦૭/૦૪/૨૦૧૬.

(૫) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૧૭/યુઓ/૧૦૬(૧૮૦૯૯૫)/ક, તા.૨૦/૦૭/૨૦૧૭.

(૬) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: બમશ/૧૦૧૧/૧૪૧૮/ગ, તા. ૦૪/૦૫/૨૦૧૮.

(૭) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/પાર્ટ/૧/ક, તા.૨૫/૦૬/૨૦૧૯.

(૮) કમિશ્નર શાળાઓની કચેરીના પત્ર ક્રમાંક : ધ/અનદ-૩/પરિપત્ર/ઉ.ના.સ./૨૦૧૯/૧૧૪૬૧/૯૫, તા. ૩૦/૦૬/૨૦૨૦.

(૯) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૨૭/૦૭/૨૦૨૦.

(૧૦) આ કચેરીના પત્રક્રમાંક : માધ્ય/ખ/૧/૨.હે.ઉ.સ./પરિપત્ર/૨૦૨૨/૭૭૯૦/૮૦૩૨, તા.૦૭/૦૯/૨૦૨૨.

(૧૧) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૨૪/૦૯/૨૦૨૨.

(૧૨) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૧૭/યુ.ઓ./૧૦૬(૧૮૦૯૯૫)/ક, તા.૨૯/૧૦/૨૦૨૨.

(૧૩) કમિશ્નર શાળાઓની કચેરીના પત્ર ક્રમાંક : ધ/અનદ-૩/ ઉ.ના.સ./ પરિપત્ર/૨૦૨૨/ ૨૪૦૫૩-૯૦, તા. ૦૪/૧૨/૨૦૨૨.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૦૫/૦૭/૨૦૧૧ના ઠરાવથી ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના કિસ્સામાં રહેમરાહે નિમણૂકને બદલે ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના અમલમાં આવેલ છે અને ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વખતોવખત ઠરાવો કરી સુધારા પણ બહાર પાડેલ છે.

ઉચ્ચક નાણાકીય સહાય દરખાસ્તની મંજૂરી માટે કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલ ચેકલીસ્ટ, પ્રમાણપત્રો અને એનેક્ષર મુજબ દરખાસ્ત રજૂ કરવામાં, શાળા તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીઓને

મૂંઝવણ અનુભવાતી હોવાનું જણાય આવતા, આ કામગીરીને વધુ સરળ બનાવવા તથા આશ્રિત અરજદારને સરકારશ્રીની રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય સમયમર્યાદામાં ચૂકવાઈ જાય તેવા ઉમદા આશયથી, આ કચેરીના સંદર્ભ (૧૦) દર્શિત પરિપત્રથી અગાઉના તમામ ચેકલીસ્ટ, પ્રમાણપત્રો અને એનેક્ષર રદ કરી નવા ચેકલીસ્ટ, પ્રમાણપત્રો અને એનેક્ષર મુજબ દરખાસ્ત રજૂ કરવા જણાવેલ હતું.

ઉક્ત સંદર્ભ (૧૦) દર્શિત પરિપત્ર બાદ સામાન્ય વહિવટી વિભાગના તા.૨૪/૦૮/૨૦૨૨ના સંદર્ભ (૧૧) દર્શિત ઠરાવથી નિયમિત ધોરણે નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના તા.૨૪/૦૮/૨૦૨૨ કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂ. ૧૪,૦૦,૦૦૦ (અંકે રૂપિયા ચૌદ લાખ પૂરા) ની ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર કરવા સુધારો બહાર પાડવામાં આવેલ છે. તેમજ સામાન્ય વહિવટી વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૨ના સંદર્ભ (૧૨) દર્શિત ઠરાવથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા.૨૯/૧૦/૨૦૨૨ કે ત્યારબાદ થયેલ અવસાનના કિસ્સામાં રૂ. ૭,૦૦,૦૦૦ (અંકે રૂપિયા સાત લાખ પૂરા) ની ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર કરવા સુધારા ઠરાવ બહાર પાડવામાં આવેલ છે. જેથી કમિશ્નર શાળાઓની કચેરીના સંદર્ભ (૧૩) દર્શિત પરિપત્રથી ચેકલીસ્ટ અને એનેક્ષર - D માં આનુસંગિક ફેરફાર કરવામાં આવેલ છે.

જેથી હવે પછીના રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર કરવાના થતા કેસોમાં આ સાથે સામેલ નવા ચેકલીસ્ટ, પ્રમાણપત્ર અને એનેક્ષર મુજબ દરખાસ્તો રજૂ કરવા આથી જણાવવામાં આવે છે.

સદરહું દરખાસ્ત રજૂ કરતી વખતે સંદર્ભ દર્શિત ઠરાવો/પરિપત્રોની સુચનાઓ અને નીચે જણાવેલ સુચનાઓ ધ્યાને લઈ દરખાસ્ત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. :

1. સ્વ.કર્મચારીના નામ અને હોદ્દોના આધાર તરીકે જિ.શિ.અ કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવતા કોમ્પ્યુટર કોડ નંબર દર્શાવતું ઓળખ કાર્ડ/આદેશની નકલ પૈકી કોઈ એક આધાર રજૂ કરવો.
2. ગ્રાન્ટેડ શાળાના આધાર તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરનો મંજૂરી પત્ર, કમિશ્નર શાળાઓની કચેરીનો વર્ગ વધારાની મંજૂરીનો પત્ર, નિભાવ ગ્રાન્ટના આદેશની પ્રમાણિત ઝેરોક્ષ નકલ, વગેરે પૈકી કોઈ પણ એક આધાર રજૂ કરવો. (એનેક્ષર - B મુજબ)
3. સ્વ.કર્મચારીના જન્મ તારીખના આધાર તરીકે લીવીંગ સર્ટીફિકેટ (એલ.સી.) ની પ્રમાણિત નકલ સામેલ રાખવી.
4. સ્વ.કર્મચારીની નોકરીમાં નિમણૂક તારીખના આધાર તરીકે નિમણૂક આદેશની પ્રમાણિત નકલ સામેલ રાખવી.
5. માત્ર ફિક્સ પગારમાં નિમણૂક પામેલ કર્મચારીના અવસાનના કિસ્સામાં, સ્વ. કર્મચારીના પાંચ વર્ષ પૂરા કર્યાના આદેશની પ્રમાણિત નકલ સામેલ રાખવી.
6. સ્વ.કર્મચારીની નિમણૂક માન્ય ભરતી પદ્ધતિથી થયેલ છે તે માટે બહાલીની નકલ અને સર્વિસબુક્માં કરવામાં આવેલ નિમણૂકની નોંધ તથા પગારધોરણની નોંધ સાથેની પ્રમાણિત નકલ આર.ઓ.પી સહિતની રજૂ કરવી. સંપૂર્ણ સેવાપોથીની ઝેરોક્ષ નકલો રજૂ કરવાની થતી નથી.
7. સ્વ. કર્મચારીના જી.પી.એફ/ સી.પી.એફ. નંબર અને તેના આધારો. (ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં PRAN નંબરના આધાર સામેલ રાખવા.) જી.પી.એફ. કપાતની અવસાન પૂર્વેની જિ.શિ.અ.શ્રીની કચેરી દ્વારા ઇસ્યુ કરેલ છેલ્લી સ્લીપ અને ઇન્ડેક્સ-બી તરફથી ઇસ્યુ કરવામાં આવતી જી.પી.એફ. કપાત સીડયુલની નકલ સામેલ રાખવાની રહે. (અવસાન થયાના મહિનાની કપાતનો સમાવેશ થતો હોય તેવી રીતે)
8. સ્વ.કર્મચારીના અવસાનના આધાર તરીકે સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ મરણનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવું.
9. સ્વ.કર્મચારીના અવસાન બાદ આશ્રિત દ્વારા રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાયની શાળાને આપવામાં આવેલ અરજીના, શાળામાં સમયમર્યાદામાં ઈનવર્ડ થયાના આધાર સામેલ રાખવા. શાળાએ અરજી સ્વીકારી તેના પર શાળાનો ઈન્વર્ડ નંબર અને તારીખ બિનચુક લખી, અસલ અરજી સામેલ રાખવી.

10. હિસાબી અધિકારીશ્રી ડી.પી.પી.એફ. કચેરી, ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરેલ કુટુંબ પેન્શન/મૃત્યુ સહ ગ્રેજ્યુઈટી મંજૂર થયેલ હોય અને તેની ચૂકવણી આશ્રિતને કરવામાં આવેલ હોય તેના આધારો સામેલ રાખવા. તેમજ નાણા વિભાગના તા.૨૩/૦૬/૨૦૦૦ ના ઠરાવ મુજબ જે તે સમયે રજૂ કરેલ સામાન્ય નિયુક્તિ ફોર્મની પ્રમાણિત નકલ સામેલ રાખવાની રહેશે. સા.વ.વિ.ના તા. ૦૫/૦૭/૨૦૧૧ના ઠરાવની શરત નં. ૩(૩) મુજબ જે આશ્રિતના નામે પેન્શન મંજૂર થયેલ હોય તે આશ્રિતના નામની જ દરખાસ્ત રજૂ કરવી.
11. સા.વ.વિ.ના તા. ૦૫/૦૭/૨૦૧૧ના ઠરાવની શરત નં. ૩(૫) મુજબ આશ્રિત ભારત સરકાર, ગુજરાત સરકાર કે અન્ય રાજ્ય સરકાર, અર્ધ સરકારી સંસ્થા, રાજ્ય/કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન, ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા/જિલ્લા પંચાયત, રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી સંસ્થાઓ (દા.ત.નાગરિક સહકારી બેંકો, જિલ્લા દુધ ઉત્પાદક સંઘો, ગુજકોમાસોલ, રાજ્યની ખેત ઉત્પાદક બજાર સમિતિઓ, જિલ્લા મધ્યસ્થ બેંકો વગેરે) તથા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના અધિનિયમ હેઠળ રચાયેલ સંસ્થાઓ પૈકી કોઈ કચેરી/સંસ્થામાં ફરજ બજાવતા નથી કે પેન્શનર નથી, તેવું નોટરી સમક્ષ કરવામાં આવેલ અસલ સોગંદનામું રૂ.૫૦/- ના સ્ટેમ્પ પેપર પર રજૂ કરવું. (સોગંદનામાનો નિયત નમૂનો આ સહ સામેલ છે તે નમૂનામાં જ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.)
12. સ્વ. કર્મચારીના કુટુંબના તમામ આશ્રિતોની સક્ષમ સત્તાધિકારીશ્રી/નોટરી/તલાટી કમ મંત્રીશ્રી દ્વારા ઇશ્યુ કરેલ અસલ પેઢીનામું સામેલ રાખવું. (નોટરી દ્વારા રજૂ થયેલ સોગંદનામું રૂ.૫૦/-સ્ટેમ્પ પર કરાવી રજૂ કરવું.)
13. મૂળ આશ્રિત અરજદારને સહાયના નાણાં ચૂકવવામાં આવે તો પેઢીનામા ઉપર ઉલ્લેખ કર્યા મુજબના બીજા અન્ય આશ્રિતને કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર નથી તે બદલના નોટરી સમક્ષ કરવામાં આવેલ અસલ સોગંદનામું રૂ.૫૦/- ના સ્ટેમ્પ પેપર પર રજૂ કરવું. (સોગંદનામાનો નિયત નમૂનો આ સહ સામેલ છે તે નમૂનામાં રજૂ કરવાનું રહેશે.)
14. સા.વ.વિ.ના તા.૦૫/૦૭/૧૧ના ઠરાવની શરત નં.(૩) મુજબ જો આશ્રિત દત્તક હોય તો હિન્દુ એડવ્શન એક્ટ-૧૯૫૬ હેઠળ દત્તક વિધાન કરી કાયદેસર દત્તક લીધેલ સંતાનના આધાર તરીકે નોટરી સમક્ષ કરેલ સોગંદનામું સામેલ રાખવું. (જો આશ્રિત પોતે જ અરજદાર હોય તો લાગુ પડતું નથી કે રજૂ કરવાનું થતું નથી.) અન્યથા દત્તક લીધેલ હોય તો અવશ્ય રજૂ કરવાનું રહેશે. (રૂ.૫૦/- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરાવી રજૂ કરવું.)
15. સ્વ.કર્મચારીએ શાળામાં બજાવેલ નોકરીનો સમયગાળો તેમજ અવસાન બાદ બાકી રહેતો નોકરીનો સમયગાળો, સત્રાંત નિવૃત્તિના સમયગાળાને ધ્યાને લીધા સિવાય અને જન્મતારીખ મુજબ અવસાન બાદ કેટલી નોકરીનો સમયગાળો વર્ષ, માસ અને દિવસની ચોક્કસ વર્ષની માહિતી દર્શાવતું નિયત એનેક્ષર-A સામેલ રાખવું.
- એનેક્ષર-A ની ગણતરીમાં સત્રાંત નિવૃત્તિનો સમયગાળો ધ્યાને લેવાનો રહેતો નથી જેથી જન્મ તારીખમાં વર્ગ-૩ ના કિસ્સામાં ૫૮ વર્ષ અને વર્ગ-૪ ના કિસ્સામાં ૬૦ વર્ષ ઉમેરો કરી તે મુજબ નિવૃત્તિની તારીખ દર્શાવવી.
16. પ્રસ્તુત કેસમાં ઉચ્ચક નાણાકીય સહાયના નાણાની ચૂકવણી કરવામાં આવેલ નથી જેની ચકાસણી સંબંધિત દફતર દ્વારા નિભાવવામાં આવતા રજીસ્ટર અને સીધા પગાર યોજના(ડી.પી.)ના બિલ/ચેક રજીસ્ટર ઉપરથી ખરાઈ કરવામાં આવેલ છે. જેથી સદર સહાય મંજૂર કરવામાં વાંધા જનક જણાતું નથી. જે બદલ એનેક્ષર-C મુજબનું પ્રમાણપત્ર રામેલ રાખવું.
17. સા.વ.વિ.ના તા.૦૭/૦૪/૨૦૧૬ ના ઠરાવની જોગવાઈ મુજબ તા.૦૧/૦૪/૨૦૧૬ કે ત્યારબાદ બાદ થયેલ અવસાનના કેસોમાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૮,૦૦,૦૦૦/-ની રકમ. અથવા સા.વ.વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬ (૧૮૦૯૯૫)-ક, તા. ૨૦/૦૭/૨૦૧૭ અનુસાર ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં તેઓએ બજાવેલ પાંચ વર્ષની ફરજ અને એક વર્ષની નિયમિત નિમણૂકના સમયગાળા દરમિયાન અવસાનના કિસ્સામાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૪,૦૦,૦૦૦/- ની રકમ. અથવા સા.વ.વિ.ના તા.૨૪/૦૯/૨૦૨૨ ના ઠરાવની જોગવાઈ મુજબ તા.૨૪/૦૯/૨૦૨૨ કે ત્યારબાદ થયેલ અવસાનના કેસોમાં

ફિક્સ કરવામાં આવેલ રૂ.૧૪,૦૦,૦૦૦/-ની રકમ. અથવા સા.વ.વિભાગના ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬ (૧૮૦૯૯૫)-ક, તા. ૨૯/૧૦/૨૦૨૨ અનુસાર ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં તેઓએ બજાવેલ પાંચ વર્ષની ફરજ અને એક વર્ષની નિયમિત નિમણૂકના સમયગાળા દરમ્યાન અવસાનના કિસ્સામાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૭,૦૦,૦૦૦/- ની રકમની વિગત દર્શાવતું નિયત એનેક્ષર-D સામેલ રાખવું.

18. સ્વ. કર્મચારીના અવસાન બાદ વધુ ચૂકવાયેલ પગારભથ્થાની રકમ સરકારશ્રીમાં પરત ભર્યા અંગેનું જિ.શિ.અ.શ્રીનું પ્રમાણપત્ર અને ચલણની નકલ સામેલ રાખવી.
19. સ્વ.કર્મચારીના આશ્રિત ધર્મપત્નીનું પણ અવસાન થાય તેવા કિસ્સામાં અરજદારના પુત્ર કે પુત્રી હોય તો તેમના નામે સહાય મંજૂર કરવાની દરખાસ્ત કરતા સમયે પ્રથમ તેમના નામે પેન્શન/મૃત્યુ સહ ગ્રેજ્યુઈટી મંજૂર થયેલ હોવું જોઈએ અને તેવા પુત્ર કે પુત્રી અપરણિત છે તે અંગેનું નોટરી/મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ હોય તે સોગંધનામું સામેલ રાખવું.
20. સ્વ.કર્મચારીને એક પત્ની હોય અને પુનઃલગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં પ્રથમ ધર્મપત્ની સાથે છૂટાછેડા લેવામાં આવેલ હોય તેના આધારો, જો છૂટાછેડા આપવામાં આવેલ ન હોય તો સદર સહાયની રકમ પુનઃલગ્ન કર્યા બાદની બીજા પત્નીને ચૂકવવામાં આવે તો પ્રથમ નંબરના ધર્મપત્નીને કોઈ પણ જાતનો વાંધો નથી તે મતલબનું બાહેધરી પત્ર તથા નોટરી/મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવેલ અસલ સોગંધનામું રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર રજૂ કરવાનું રહેશે.
21. ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર શાળાના કર્મચારીના આશ્રિતને સામાન્ય વહિવટી વિભાગના તા.૨૭/૦૭/૨૦૨૦ ના ઠરાવની જોગવાઈ મુજબ સ્વ.કર્મચારીની અવસાનની તારીખથી એક વર્ષની મુદ્દત દરમ્યાન આશ્રિત કુટુંબના લાયક સભ્યએ નિયમાનુસારની ઉચ્ચક નાણાકીય સહાય મેળવવાની અરજી કરવાની રહેશે. પરંતુ આ સમયમર્યાદાએ મહત્તમ મર્યાદા છે.

કેટલાક કિસ્સાઓમાં શાળાઓ દ્વારા સદરહુ દરખાસ્ત એક વર્ષની સમયમર્યાદાના અંતિમ માસમાં રજૂ કરવામાં આવે છે. જેથી દરખાસ્તની મંજૂરી મેળવવામાં વિલંબ થાય છે. ઉચ્ચક નાણાકીય સહાયની યોજનાનો મૂળ હેતુ સ્વ. કર્મચારીશ્રીના આશ્રિતને નાણાકીય ભીંસમાં રાહત આપવાનો અને આવી પડેલ આકસ્મિક કટોકટીમાં પહોંચી વળવા માટે મદદરૂપ થવાનો છે, જે શુભ આશય ખરા અર્થમાં ફળીભૂત થતો નથી.

અમુક કિસ્સાઓમાં દરખાસ્ત વિલંબથી રજૂ કરવા બાબતે શાળાઓ પાસેથી ખુલાશો પૂછતાં, આશ્રિત અભણ છે, શોક મગ્ન હતા, ડિપ્રેશનમાં હતાં, સામાજિક રીત રિવાજો પૂરા કરવામાં તથા આધાર પૂરા પાડવામાં વિલંબ થયેલ છે તેવા પ્રત્યુત્તર અત્રેની કચેરીને પાઠવી આપે છે જે વ્યાજબી ગણાય નહીં.

આમ, શાળાના આચાર્યશ્રીએ સંબંધિત કર્મચારીનું અવસાન થતાની સાથે તેઓના આશ્રિત કુટુંબના લાયક સભ્યની ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા અંગેની અરજી સત્પરે મેળવી લેવાની રહેશે તેમજ આશ્રિત અરજદારે રજૂ કરવાના થતાં આધારો જેવા કે મરણનું પ્રમાણપત્ર, પેઢીનામું, સોગંધનામા, વગેરે જેવા ખૂટતા આધારો રજૂ કરવા માહિતગાર કરવા તેમજ આધારો સમયસર રજૂ કરવા બાબતે સમયાંતરે આશ્રિત અરજદારને પત્ર/સ્મૃતિપત્રો પાઠવવાની જવાબદારી આચાર્યશ્રીની રહેશે.

આશ્રિત અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં અરજી કરવામાં આવેલ હશે પરંતુ શાળા દ્વારા લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવેલ હોવાનું ધ્યાને આવશે તો શાળાના આચાર્યશ્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે. જેની નોંધ લેવી.

22. દરખાસ્તમાં શરૂઆતથી રજૂ કરેલ તમામ રેકર્ડને પેન્સીલથી સળંગ પાના નંબર (૧,૨,૩,૪, ...) આપવા તથા તે પાના નંબર ચેકલિસ્ટમાં લાગુ પડતા કોલમમાં અવશ્ય દર્શાવવાના રહેશે.

23. દરખાસ્તમાં કોઈ પણ જાતના સહિ-સિક્કા, તારીખ, પત્ર ક્રમાંક, આપક નં., જાવક નં. લખવાના બાકી નથી અને કોઈ પણ આધાર બિડાણ કરવાના બાકી નથી તેની ખાત્રી કર્યા બાદ જ દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

24. ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્તની ફાઇલ બે નકલ (**COS કોપી અને DEO કોપી**) તૈયાર કરવાની રહેશે. બંને ફાઇલો પર આ સાથે સામેલ નમુનાનું કવર પેઇજ ચોંટાડવાનું રહેશે.

25. સદરહું દરખાસ્તો કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા ઈ-સરકાર પોર્ટલ પર PDF ફાઇલમાં નિયત સાઈઝ લિમિટ (MB)માં અપલોડ કરવાની થતી હોવાથી, ઉપર જણાવ્યા મુજબના જરૂરી આધારો સિવાય વધારાના આધારો દરખાસ્તમાં સામેલ રાખવાના રહેશે નહિ. વધુમાં ઉપર જણાવ્યા મુજબ દરખાસ્તની હાર્ડકોપી સાથે દરખાસ્તની સુવાચ્ય રીતે SCAN કરેલ PDF ફાઇલ (સોફ્ટ કોપી) પણ રજૂ કરવાની રહેશે.

26. સદરહું દરખાસ્તો ચેક્યાક રહિત તૈયાર કરવાની રહેશે.


જિલ્લા શિક્ષણાધિકારી
રાજકોટ

બિડાણ : -

- ❖ નવું સુધારેલ ચેકલીસ્ટ, ત્રણ પ્રમાણપત્રો, એનેક્ષર - A થી D,
- ❖ ફાઇલો પર ચોંટાડવાના કવર પેઇજનો નમુનો
- ❖ બે સોંગદનામાના નમુના

સુધારા-વધારા સાથેનું રહેમરાહે ઉચ્ચક સહાય મેળવવા અંગેનું નિયત નમુનાનું ચેકલીસ્ટ

1. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૦૫/૦૭/૨૦૧૧
2. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: બમશ/૧૦૧૧/૧૪૧૮/ગ, તા.૦૨/૦૧/૨૦૧૨
3. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૧૩/૧૦/૨૦૧૫
4. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૦૭/૦૪/૨૦૧૬.
5. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક,તા.૨૦/૦૭/૨૦૧૭
6. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૨૭/૦૭/૨૦૨૦
7. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૨૪/૦૯/૨૦૨૨.
8. સા. વ. વિ.ના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૧૭/યુ.ઓ./૧૦૬(૧૮૦૯૯૫)/ક, તા.૨૯/૧૦/૨૦૨૨.

ક્રમ	વિગત	આધારો (ટાઇપ કરીને જ રજૂ કરવું.)	પાનાં નં.
1	સ્વ. કર્મચારીનું નામ અને હોદ્દો		
2	શાળાનું નામ અને સરનામું તથા શાળા ગ્રાન્ટેડ છે તેનો આધાર સામેલ રાખવા (એનેક્ષર-બી મુજબ)		
3	સ્વ. કર્મચારીની એલ.સી.મુજબની જન્મ તારીખ (એલ.સી. ની નકલ સામેલ રાખવી.)		
4	સ્વ. કર્મચારીના નિમણૂક આદેશ મુજબ નિમણૂક તારીખ (નિમણૂક આદેશની નકલ સામેલ રાખવી.)		
5	સ્વ. કર્મચારીના પાંચ વર્ષ પૂરા કર્યાની તારીખ (આદેશની નકલ સામેલ રાખવી) (માત્ર ફિક્સ પગારમાં નિમણૂક પામેલ કર્મચારીના અવસાનના કિસ્સામાં)		
6	સ્વ. કર્મચારીની નિમણૂક માન્ય ભરતી પદધત્તિ થી થયેલ છે તે અંગેનું જિ.શિ.અ.શ્રી નું પ્રમાણપત્ર અથવા બહાલીની નકલ		
7	સ્વ. કર્મચારીના જી.પી.એફ/ સી.પી.એફ. નંબર અને તેના આધારો (ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં PRAN નંબરના આધાર સામેલ રાખવા.)		
8	મરણના પ્રમાણપત્ર મુજબ અવસાન થયાની તારીખ		
9	જન્મતારીખને ધ્યાને લઈ ખરેખર નિવૃત્તિની તારીખ		
10	સ્વ.કર્મચારીના અવસાન બાદ આશ્રિત દ્વારા રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાયની શાળાને આપવામાં આવેલ અરજી મુજબ આશ્રિતનું નામ અને અરજીની તારીખ (શાળામાં ઈનવર્ડ થયાના આધાર સામેલ રાખવા)		
11	હિસાબી અધિકારીશ્રી ડી.પી.પી.એફ. કચેરી, ગાંધીનગર દ્વારા ઈસ્યુ કરેલ કુટુંબ પેન્શન/મૃત્યુ સહ ગ્રેજ્યુઈટી મંજુર થયેલ હોય અને તેની ચૂકવણી આશ્રિતને કરવામાં આવેલ હોય તેના આધારો મુજબ આશ્રિત અરજદારનું પુરૂ નામ અને સરનામું		
12	સા.વ.વિ.ના તા. 5/7/11ના ઠરાવની શરત નં. ૩(5) મુજબ અરજદારશ્રી કોઈપણ કચેરી/સંસ્થા બોર્ડ નિગમ કે સહકારી મંડળી જેવી અન્ય સંસ્થાઓમાં ફરજો બજાવતા નથી તેવું નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામું સ્ટેમ્પ નંબર અને તારીખ સહિત (રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર સોગંદનામું કરાવી રજૂ કરવું.)		
13	સ્વ. કર્મચારીના કુટુંબના તમામ આશ્રિતોની સક્ષમ સત્તાધિકારીશ્રી/નોટરી/તલાટી કમ મંત્રીશ્રી દ્વારા ઈસ્યુ કરેલ પેઢીનામું અને તારીખ (નોટરી દ્વારા રજૂ થયેલ સોગંદનામું રૂ.૫૦/-સ્ટેમ્પ પર કરાવી રજૂ કરવું.)		

14	<p>મૂળ આશ્રિત અરજદારને સહાયના નાણાં ચૂકવવામાં આવે તો પેઢીનામા ઉપર ઉલ્લેખ કર્યા મુજબના બીજા અન્ય આશ્રિતોને કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર નથી તે બદલના નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામા સ્ટેમ્પ નંબર અને તારીખ (રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર સોગંદનામું કરાવી રજૂ કરવું.)</p>								
15	<p>સા.વ.વિ.ના તા.૦૫/૦૭/૧૧ના ઠરાવની શરત નં.(૩) મુજબ જો આશ્રિત દત્તક હોય તો હિન્દુ એડવૅશન એક્ટ-૧૯૫૬ હેઠળ દત્તક વિધાન કરી કાયદેસર દત્તક લીધેલ સંતાનના આધાર તરીકે નોટરી સમક્ષ કરેલ સોગંદનામું સામેલ રાખવું. (જો આશ્રિત પોતે જ અરજદાર હોય તો લાગુ પડતુ નથી કે રજૂ કરવાનું થતુ નથી.) અન્યથા દત્તક લીધેલ હોય તો અવશ્ય રજૂ કરવાનું રહેશે. (રૂ.૫૦/- ના સ્ટેમ્પ પર સોગંદનામું કરાવી રજૂ કરવું.)</p>								
16	<p>સ્વ.કર્મચારીએ બજાવેલ સેવાનો સમયગાળો (એનેક્ષર - એ)</p>	<table border="1"> <thead> <tr> <th>વર્ષ</th> <th>માસ</th> <th>દિવસ</th> </tr> </thead> <tbody> <tr> <td></td> <td></td> <td></td> </tr> </tbody> </table>	વર્ષ	માસ	દિવસ				
વર્ષ	માસ	દિવસ							
17	<p>અવસાન બાદ બાકી રહેતી સેવાનો સમયગાળો (એનેક્ષર - એ)</p>	<table border="1"> <thead> <tr> <th>વર્ષ</th> <th>માસ</th> <th>દિવસ</th> </tr> </thead> <tbody> <tr> <td></td> <td></td> <td></td> </tr> </tbody> </table>	વર્ષ	માસ	દિવસ				
વર્ષ	માસ	દિવસ							
18	<p>પ્રસ્તુત કેસમાં ઉચ્ચક નાણાકીય સહાયના નાણાની ચૂકવણી કરવામાં આવેલ નથી જેની ચકાસણી સંબંધિત દફતર દ્વારા નિભાવવામાં આવતા રજીસ્ટર અને સીધા પગાર યોજના(ડી.પી.)ના બિલ/ચેક રજીસ્ટર ઉપરથી ખરાઈ કરવામાં આવેલ છે. જેથી સદર સહાય મંજૂર કરવામાં વાંધા જનક જણાતું નથી. જે બદલ એનેક્ષર-C મુજબનું પ્રમાણપત્ર</p>								
19	<p>સા.વ.વિ.ના તા.૦૭/૦૪/૨૦૧૬ ના ઠરાવની જોગવાઈ મુજબ તા.૦૧/૦૪/૨૦૧૬ બાદ થયેલ અવસાનના કેસોમાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૦૮,૦૦,૦૦૦/-ની રકમ . (એનેક્ષર-D મુજબ)</p> <p style="text-align: center;"><u>અથવા</u></p> <p>સા.વ.વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬ (૧૮૦૯૯૫)-ક, તા. ૨૦/૦૭/૨૦૧૭ અનુસાર ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં તેઓએ બજાવેલ પાંચ વર્ષની ફરજ અને એક વર્ષની નિયમિત નિમણૂકના સમયગાળા દરમ્યાન અવસાનના કિસ્સામાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૪,૦૦,૦૦૦/- ની રકમ. (એનેક્ષર-D મુજબ)</p> <p style="text-align: center;"><u>અથવા</u></p> <p>સા.વ.વિ.ના તા.૨૪/૦૯/૨૦૨૨ ના ઠરાવની જોગવાઈ મુજબ તા.૨૪/૦૯/૨૦૨૨ કે ત્યારબાદ થયેલ અવસાનના કેસોમાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૧૪,૦૦,૦૦૦/-ની રકમ.</p> <p style="text-align: center;"><u>અથવા</u></p> <p>સા.વ.વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬ (૧૮૦૯૯૫)-ક, તા. ૨૯/૧૦/૨૦૨૨ અનુસાર ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં તેઓએ બજાવેલ પાંચ વર્ષની ફરજ અને એક વર્ષની નિયમિત નિમણૂકના સમયગાળા દરમ્યાન અવસાનના કિસ્સામાં ફિક્સ કરવામાં આવેલ રૂ.૭,૦૦,૦૦૦/- ની રકમ</p>								

20	સ્વ. કર્મચારીના અવસાન બાદ વધુ ચૂકવાયેલ પગારભથ્થાની રકમ સરકારશ્રીમાં પરત ભર્યા અંગેનું જિ.શિ.અ.શ્રીનું પ્રમાણપત્ર અને ચલણની નકલ સામેલ રાખવી.		
----	---	--	--

શાળામાં આ કામગીરી સંભાળનારનું નામ અને હોદ્દો: મોબાઈલ નંબર :

સ્થળ :

તારીખ :

પ્રમુખ/મંત્રી

શાળામંડળના સહિ/સિક્કા

આચાર્યના

સહિ/સિક્કા

સ્થળ :

તારીખ :



જિલ્લા શિક્ષણાધિકારી

સહિ તથા સિક્કા

એનેક્ષર-A

શાળાના કર્મચારીએ નોકરીમાં બજાવેલ ફરજનો સમયગાળો તેમજ બાકી રહેતી નોકરીના સમયગાળાની માહિતી દર્શાવતું પત્રક

શાળાનું નામ :

સ્વ.કર્મચારીનું નામ :

<u>ચાલુ નોકરીમાં બજાવેલ ફરજનો સમયગાળો</u>				
(૧)	વિગત	દિવસ	માસ	વર્ષ
	અવસાન તારીખ			
	નિમણૂક તારીખ			
	કુલ નોકરીમાં ફરજ બજાવેલ સમયગાળો			
<u>જે વધારે વર્ષમાંથી ઓછા વર્ષ બાદ કરતા</u>				
(૨)	વિગત	દિવસ	માસ	વર્ષ
	જ.તા. મુજબ ખરેખર નિવૃત્તિની તારીખ			
	અવસાનની તારીખ			
	બાકી રહેતી નોકરી			

પ્રમુખ/મંત્રી
કેળવણી મંડળનું નામ પુરું સરનામું

આચાર્યના
સહી / સિક્કા

સ્થળ :

તારીખ :



જિલ્લા શિક્ષણાધિકારી
સહી તથા સિક્કો

એનેક્સર-B

1. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૦૫/૦૭/૨૦૧૧
2. શિક્ષણ વિભાગના ઠરાવ ક્ર:બમશ/૧૦૧૧/૧૪૧૮/ગ, તા.૦૨/૦૧/૨૦૧૨
3. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૧૩/૧૦/૨૦૧૫
4. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક, તા. 20/072017
5. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૨૭/૦૭/૨૦૨૦

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ-૩ અને વર્ગ-૪ના બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબને રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા અંગે.

પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, સ્વ.કર્મચારીશ્રી.....ની ઉચ્ચક સહાય મેળવવાની રજુ કરેલ દરખાસ્ત ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબના સભ્ય શ્રી/શ્રીમતી.....ની રજુ કરવામાં આવેલ છે. સ્વ. કર્મચારી "નોન ગ્રાન્ટેડ શાળા" ના કર્મચારી નથી. તે અંગેની મેં જાતે આ અંગેના રેકર્ડની ખરાઈ તેમજ ચકાસણી કરેલ છે. જે બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

પ્રમુખ/મંત્રી

કેળવણી મંડળનું નામ પુરું સરનામું

આચાર્યના

સહી / સિક્કા

સ્થળ :.....

તારીખ :.....



જિલ્લા શિક્ષણાધિકારી

સહી તથા સિક્કો

એનેક્ષર-૯

1. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:૨૬૫/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૦૫/૦૭/૨૦૧૧
2. શિક્ષણ વિભાગના ઠરાવ ક્ર:૭૫૩/૧૦૧૧/૧૪૧૮/ગ, તા.૦૨/૦૧/૨૦૧૨
3. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:૨૬૫/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૧૩/૧૦/૨૦૧૫
4. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: ૨૬૫-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક, તા.૨૦/૦૭/૨૦૧૭
5. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:૨૬૫/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૨૭/૦૭/૨૦૨૦

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વર્ગ-૩ અને વર્ગ-૪ના બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબને રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા અંગે.

પ્રમાણપત્ર

સ્વ.કર્મચારીશ્રી.....ના આશ્રિત અરજદાર શ્રી..... ની રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર કરવાની રજૂઆત પ્રથમ વખત જ શાળા કક્ષાએથી રજૂ થયેલ છે. જે દરખાસ્તને અગાઉ અત્રેની કચેરી કે આપની કચેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ નથી કે આવી સહાયના નાણાની ચુકવણી પણ કરવામાં આવેલ નથી જેની ચકાસણી મેં જાતે સંબંધિત દફતર દ્વારા નિભાવવામાં આવતા રજિસ્ટર તેમજ સીધા પગાર યોજના (ડી.પી.) શાખા ના બિલ/ચેક રજિસ્ટર ઉપરથી ખરાઈ કરવામાં આવેલ છે. જેથી સદર સહાયની રકમ મંજૂર કરવા વાંધાજનક જણાતુ નથી. જે બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

સ્થળ :

તારીખ :



જિલ્લા શિક્ષણાધિકારી
સહી તથા સિક્કો

એનેક્ષર-D

1. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૦૫/૦૭/૨૦૧૧
2. શિક્ષણ વિભાગના ઠરાવ ક્ર:બમશ/૧૦૧૧/૧૪૧૮/ગ, તા.૦૨/૦૧/૨૦૧૨
3. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૧૩/૧૦/૨૦૧૫
4. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૦૭/૦૪/૨૦૧૬
5. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક, તા.૨૦/૦૭/૨૦૧૭
6. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર:રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા.૨૭/૦૭/૨૦૨૦
7. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક, તા. ૨૪/૦૯/૨૦૨૨
8. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર: રહમ/૧૦૨૦૧૭/યુ.ઓ./૧૦૬(૧૮૦૯૯૫)/ક, તા. ૨૯/૧૦/૨૦૨૨

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ-૩ અને વર્ગ-૪ના બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબને રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા અંગે.

:- જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આપવાનું પ્રમાણપત્ર :-

સંસ્થાનું નામ :
 અરજદારનું નામ :

સ્વ.કર્મચારીશ્રી.....હોદ્દો.....જગ્યા પર નિયમિત ધોરણે ભરતીની તમામ પ્રક્રિયા મુજબ નિમાયેલ હતા. સ્વ.કર્મચારીના આશ્રિત વારસદાર શ્રી.....એ ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-..... ના કર્મચારીના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા અંગે તા.....ના રોજ સહાય મેળવવાની રજુઆત કરેલ છે. સામાન્ય વહીવટ વિભાગના તા..... ઠરાવની જોગવાઈ મુજબ નીચે દર્શાવેલ જોગવાઈના ક્રમ નં..... મુજબ આશ્રિતને રૂ..... (અંકે રૂપિયા..... પુરા)ની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા ભલામણ સહ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ક્રમ	નીચે દર્શાવેલ લાગુ પડતી જોગવાઈ મુજબ રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય મંજુર કરવાપાત્ર થાય છે તો સામેના ખાનામાં “ જે જોગવાઈ લાગુ પડતી હોય તેની સામે ‘હા’ દર્શાવવું “.	હા/ના
૧	સામાન્ય વહીવટ વિભાગના તા.૦૫/૦૭/૨૦૧૧ના ઠરાવના ફકરા-૩(૩) વિગતે સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને પેન્શન મંજુર થવા પાત્ર છે જે અંગેની ડી.પી.પી.એફ.કચેરી, ગાંધીનગર દ્વારા પી.પી.ઓ.નંબરના આદેશના આધારે ખરાઈ કરેલ છે. (આધાર રજુ કરવા)	
૨	ફિક્સ પગારમાં નિમણૂક પામેલ કર્મચારી કે જેઓ પૂરા પગારમાં આવ્યા બાદ ૦૬ વર્ષ કે તેથી વધુ સમયની નોકરી બજાવેલ હોય તેમના અવસાનના કિસ્સામાં આશ્રિત અરજદારને સ્વ. કર્મચારીના અવસાન બાદ મૃત્યુ સહ ગ્રેજ્યુઈટી મંજુર થયેલ છે અને તેની ચૂકવણી આશ્રિત અરજદારને કરવામાં આવેલ છે. તેની ખરાઈ કરેલ છે. (આધાર રજુ કરવા)	
૩	સા.વ.વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક, તા. ૨૦/૦૭/૨૦૧૭ અને તા. ૨૯/૧૦/૨૦૨૨ની જોગવાઈઓ અનુસાર ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં તેઓએ બજાવેલ પાંચ વર્ષની ફરજ અને એક વર્ષની નિયમિત નિમણૂકના સમયગાળા દરમ્યાન અવસાનના કિસ્સાની ખરાઈ કરેલ છે. (આધાર રજુ કરવા)	

સ્થળ
 :

પ્રમુખ/મંત્રી
 કેળવણી મંડળનું નામ પુરું સરનામું

આચાર્યના
 સહી / સિકકો

કચેરીનું
 નંબર નીચે

જિલ્લા શિક્ષણાધિકારી
 નોંધી / મિત્રો

શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર

ઉક્ત ચેકલીસ્ટમાં દર્શાવ્યા મુજબ, મેં જાતે સદર કેસની ચકાસણી કરેલ છે અને તમામ વિગતો ક્રમમાં પાના નં સહિત લાગુ પડતા તમામ આધારો સામેલ રાખેલ છે. અને ક્યાંય પણ કોઈપણ જાતના સહી-સિક્કા, તારીખ નં., આવક નં., જાવક નં સિવાયના આધારો સામેલ રાખેલ નથી જેની મેં જાતે ચકાસણી કરેલ છે. તથા આ સિવાય કોઈ આધારો બિડાણ કરવાના બાકી રહેતા નથી તે સબબનું આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે, સરકારશ્રીની જોગવાઈ મુજબ સ્વ. કર્મચારી શ્રી ના આશ્રિત અરજદાર શ્રી/શ્રીમતી..... ને રહેમરાહે ઉચ્ચક નાણાકીય સહાય રૂ. મંજૂર કરવા આથી ભલામણ કરવામાં આવે છે.

આપનો વિશ્વાસુ,

સ્થળ :

તારીખ :

શાળાના આચાર્ય/પ્રમુખ/મંત્રી

સહી/સિક્કા

સંસ્થાનું નામ

નોંધ:- શાળાના આચાર્યશ્રીના અવસાનના કિસ્સામાં શાળાના સંચાલક મંડળના પ્રમુખશ્રી/મંત્રીશ્રી ની

સહી કરાવી સદર પ્રમાણપત્ર રજૂ કરવું.

પ્રમાણપત્ર

ઉક્ત ચેકલીસ્ટમાં દર્શાવ્યા મુજબ, મેં જાતે સદર કેસની ચકાસણી કરેલ છે અને તમામ વિગતો ક્રમમાં પાના નં સહિત લાગુ પડતા તમામ આધારો સામેલ રાખેલ છે. અને ક્યાંય પણ કોઈપણ જાતના સહી-સિક્કા, તારીખ નં., આવક નં., જાવક નં સિવાયના આધારો સામેલ રાખેલ નથી જેની મેં જાતે ચકાસણી કરેલ છે. તથા આ સિવાય કોઈ આધારો બિડાણ કરવાના બાકી રહેતા નથી તે સબબનું આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. સરકારશ્રીની જોગવાઈ મુજબ સ્વ. કર્મચારી શ્રી ના આશ્રિત અરજદાર શ્રી/શ્રીમતી..... ને રહેમતરાહે ઉચ્ચક નાણાંકીય સહાય રૂ. મંજૂર કરવા આથી લલામણ કરવામાં આવે છે.

આપનો વિશ્વાસુ,

સ્થળ :

તારીખ :



જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

પ્રમાણપત્ર

સ્વ. કર્મચારીશ્રી..... નું ચાલુ ફરજ દરમ્યાન તા..... ના રોજ અવસાન થયેલ છે. તેઓના અવસાન બાદ વધુ ચૂકવાયેલ પગારભથ્થાની રકમ રૂ..... (અંકે.....) સરકારશ્રીમાં ચલણથી પરત ભરેલ છે. (ચલણના આધાર સામેલ રાખવા) જે બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આપનો વિશ્વાસુ,

સ્થળ :

તારીખ :



જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા અંગેના તા.૫/૭/૨૦૧૧ના ઠરાવ મુજબના
નિયત સોંગદનામાનો નમુનો

આથી સોંગદનામું કરવામાં આવે છે કે, સ્વ. શ્રી

ના વારસદાર પતિ/પત્ની નામે શ્રી.....

ઉંમર..... ધંધો.....રહે..... તા..... જિ..... આશ્રીત વારસદાર તે

મારા ધર્મના સોંગદ ઉપર જાહેર કરીએ છીએ કે અમો નામે શ્રી.....

..... ભારત સરકાર, ગુજરાત સરકાર કે અન્ય રાજ્ય સરકાર, અર્ધ

સરકારી સંસ્થા, રાજ્ય/કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન, ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ, સ્થાનિક

સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા/જિલ્લા પંચાયત, રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી સંસ્થાઓ (દા.ત.નાગરિક

બેંકો, જિલ્લા સહકારી દુધ ઉત્પાદકો, સંઘો, ગુજકોમાસોલ, રાજ્યની ખેત ઉત્પાદક બજાર સમિતિઓ,

જિલ્લા મધ્યસ્થ બેંકો વગેરે) તથા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના અધિનિયમ હેઠળ ચલાયેલ સંસ્થાઓ

પૈકી કોઈ કચેરી/સંસ્થામાં ફરજ બજાવતા નથી કે પેન્શનર નથી.

ઉપરોક્ત માહિતી મારી જાણ અને માન્યતા મુજબ સાચી અને ખરી છે. ખોટું સોંગદનામું કરવું એ

ફોજદારી ગુન્હો છે. જેની મને જાણ છે.

સ્થળ :

તારીખ :

સહિ

મૂળ આશ્રિત અરજદારને સહાયના નાણાં ચૂકવવામાં આવે તો પેઢીનામા ઉપર
ઉલ્લેખ કર્યા મુજબના બીજા અન્ય આશ્રિતોને કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર નથી તે

બાબતના સોગંદનામાનો નમુનો

આથી હું નીચે સહિ કરનાર (આશ્રિત અરજદાર સિવાયના તમામ વારસદારો)
..... ઉ.વ. ધર્મે ધંધો સરનામું
..... આથી મારા ધર્મના સોગંદનામાં
ઉપર જાહેર કરું કે, હું સ્વ.શ્રી ના વારસ
પુત્ર/પુત્રી છું.

મારા પિતા/માતા સ્વ.શ્રી મુકામે
..... શાળામાં તરીકે ફરજ
બજાવતા હતા. તેઓનું તા..... ના રોજ ચાલુ ફરજ દરમ્યાન અવસાન થયેલ છે. સરકારશ્રીની
જોગવાઈ મુજબ મારા પિતા/માતાના અવસાન બાદ મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમ મારા
માતા/પિતાશ્રીને મળે તે અંગે મારે કોઈ વાંધો કે તકરાર નથી અને ભવિષ્યમાં હું આ બાબતે કોઈ વાંધો કે તકરાર
લઈશ નહિ.

સદરહું સોગંદનામું સરકારી કચેરીમાં રજૂ કરવાનું હોઈ હું આ સોગંદનામું કરૂ છું. હું જાણું છું કે,
સોગંદનામામાં ખોટી હકીકત જાહેર કરવાથી સજા પાત્ર ગુન્હો બને છે.

ઉપરની હકીકત અને વિગતો ખરી અને સત્ય છે જે મારા ધર્મના સોગંદ ઉપર સત્ય પ્રતિજ્ઞા પૂર્વક જાહેર
કરું છું.

સ્થળ :

તારીખ :

સહિ

(ફક્ત ફાઇલના પૂંઠા ઉપર ચોંટાડવા માટે)

સ્વ. કર્મચારીઓના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી સંપૂર્ણ તૈયાર થયેલ તમામ કેસોની ઉચ્ચક નાણાકીય સહાયની ફાઇલ ઉપર ચીપકાવવાનું / ચોંટાડવાનું નિયત નમુનાનું પત્રક :

જિલ્લા નું નામ :

જિલ્લાની કચેરીનો રજી. ક્રમ નંબર :

જિલ્લાની કચેરીનો ફાઇલ નંબર :

નિયામકશ્રી શાળાઓની કચેરી, ૯/૧, ડૉ. જી.મ.ભ., ગુ.રા., ગાંધીનગર (માધ્યમિક શાળા)

રજી. નંબર :

અનંદ— ૩

ફાઇલ નંબર

શાળાનું નામ અને પૂરું સરનામું (પીન કોડ સાથેનું)	:	
સ્વ. કર્મચારીનું નામ અને હોદ્દો	:	
જી.પી.એફ. વાળા છે કે સી.પી.એફ. વાળા છે ?	:	
એલ.સી.મુજબ જન્મ તારીખ	:	
પ્રથમ નિમણૂક તારીખ	:	
પાંચ વર્ષ પૂરા કર્યાની તારીખ (ફિક્સ પગારમાં નિમણૂક પામેલ કર્મચારીઓના અવસાન કિસ્સામાં.)	:	
મરણના પ્રમાણપત્ર મુજબ અવસાનની તારીખ	:	
જન્મ તારીખને ધ્યાને લઈ વયનિવૃત્તિ તારીખ	:	
પ્રથમ નિમણૂકથી બજાવેલ ફરજનો સમયગાળો	:	વર્ષ - માસ - દિવસ -
બાકી રહેતી નોકરીનો સમયગાળો	:	વર્ષ - માસ - દિવસ -
મળવાપાત્ર રકમ રૂ.	:	
અવસાનની તારીખ સુધી સ્વ.કર્મચારીનો જે બેંકમાં પગાર જમા થતો હતો તે બેંકનું પૂરું નામ અને સરનામું ખાતા નંબર સાથે	:	બેંકનું નામ : ખાતા નંબર :
સ્વ.કર્મચારીના આશ્રિતનું નામ અને હાલનું પૂરું કાયમી સરનામું (સહાયની અરજી/સોંગઘનામા મુજબનું અવશ્ય દર્શાવવું.)	:	નામ : સરનામું : પીન કોડ નં. મોબાઈલ નં.
આશ્રિત પૈકી પતિ/પત્ની/પુત્ર/પુત્રી કે દત્તક લેવામાં આવેલ આશ્રિતનું નામ	:	